



### તત્ત્વ સ્વરૂપ - ઉ

હે પ્રભુ,

આપની તરફનો મારો આ અહોભાવ, ગદગદ ભાવ, હંમેશા દિને દિને ઓતપ્રોત થઈને વહેવા માટે અને જ્યાં સુધી આપ સમ ન બનું, જ્યાં સુધી મારો આ ભવ ભ્રમણનો અંત ન આવે ત્યાં સુધી સદા ને સદા માટે તારો અને મારો સંબંધ બંધાઈ ને કાયમ રહે એજ મારી ભાવના છે (૩).

હે અરિહંત પરમાત્મા,

છેલ્લા દ દિવસથી સતત આપે જેમ બતાવ્યું છે એમ પર્યુષણ મહાપર્વના દિવસનો અવસરનો પૂરેપૂરો દ્રવ્યથી લાભ લઈને અહીં આપના પ્રાંગણશમાં ૧૨-૧૨ કલાક સુધી બેસુ છું. માત્ર આપનું ધ્યાન કરું છું. તેમ છતાં કંઈક ખૂટી રહ્યું છે એવું અંદરથી લાગે છે. આપે બતાવેલ તત્ત્વનું ચિંતન વારંવાર કરી રહ્યો છું, છતાં પણ એમ લાગે છે આપે જે બતાવ્યું છે એવું દિનન મારી અંદરપ્રગટ થતું નથી.

હે અરિહંત પરમાત્મા,

આવું શું કામ થાય છે ?

આપની હાજરી છે એ વર્તય છે, એ સમજાય છે એટલે મારી લાગણીઓ અને ઉમ્મીઓ જે આમતેમ ભાગતી હતી એ આપની અંદર એકરૂપ તો થઈ છે પણ ક્યાંક ક્યાંક કચાશ અવશ્ય દેખાય છે.

હે પ્રભુ,

બસ... મને તારા સ્વરૂપની સાથે, તારા તત્ત્વની સાથે એકલીન થઈને એકદોર થવું છે. મારે હવે મારી બુધ્યિ વપારવી જ નથી. તારા શરણ દ્વારા તારા ચરણાની સેવા દ્વારા જે કાંઈ પણ મારે કરવાનું હોય એ તું આપોઆપ તારી છિત્રછાયામાં કરાવજે. આજ મારા અંતરનો ભાવ છે... (૩)

હે અરિહંત પરમાત્મા,

આપના દીધેલ વચનો સાંભળી સાંભળીને એ નિર્જર્ખ પર આવ્યો છું કે તમારી હાજરી એ મારો માર્ગ છે, આપના વચનો એ જ મારો ધ્યેય છે. આપે બતાવેલ લક્ષ એ જ મારું લક્ષ થાય. જ્યાં સુધી આ ભવભ્રમણની અંદર મારું લક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપની હાજરી મારી સાથે અને સાથે કોઈ પણ સ્વરૂપે કોઈ પણ અવસ્થા, કોઈ પણ સ્થિતિમાં હાજર રહે અને અપ્રમત બની આપના માર્ગની અંદર વહન કરું એવી મારી ઈચ્છા છે અને આપને એવું સામર્થ્ય બળ

શુભેચ્છા :

આપવા હું પ્રાર્થના કરું છું, અર્થના કરું છું, આપના ચરણશમાં આશ્રય લઉં છું (૩).

નમો જિણાણાં.

### યથાર્થ ચિંતન ક્યારે થાય ?

અમલમાં મૂકે ત્યારે...

અમલમાં મૂકીએ ત્યારે ખબર પડે તત્ત્વ શું છે. વર્ષાના વર્ષા આવા ચિંતન કર્યા કરીએ, અમલમાં ન મૂકાય તો એ વથાર્થ ચિંતન છે. ક્યારે આ મનુષ્યનું station છૂટૂ જ્શે એનો કોઈ ભરોસો નથી એટલે Scientist બનવું આવશ્યક છે.

આપણો આંતરિક chemistry જોઈ. જો આ નહીં સમજાય તો આજની meta physic નહીં સમજાય. આ chemistry દ્વારા meta physic ઉભું થાય છે.

કાર્મણ શરીરમાંથી ઉદ્ય ભાવે સતત કર્મ અંતઃકરણમાં આવે છે, અને બહારના જગતનું ઇંડ્રિય દ્વારા જોડાણ થાય છે. ઇંડ્રિય મન ને data આપે છે, બુધ્યિ એને ચકાસે છે. મોહજનિત અહેકાર અહીં દોસ્ત બનીને હાજર છે જે ચિત્તને સૂવારી દે છે અને પોતાની action શરૂ કરી દે છે, એટલે મોહજનિત instruction પ્રાપ્ત થાય છે. ચિત્ત પ્રમાદ અવસ્થામાં સૂર્ય જઈ, લક્ષ ભૂલી જાય ત્યારે મોહ બુધ્યિને control કરે, બુધ્યિ મનને direction આપે, મન કર્મન્દ્રિયોને command આપે.

ગમા અને અણાગમા મોહ ઉભા કરે છે. જેવો ચિત્ત સૂર્ય જાય, પ્રમાદને વશ એટલે મોહ અંતઃકરણની system ને control માં લઈ લે અને મોહજનિત ગમા અને અણાગમા ઉભા કરાવે. આ ગમા અણાગમા બુધ્યિ-મન અને કર્મન્દ્રિય દ્વારા વ્યક્ત થાય. આ રીતે આપણી અજ્ઞાનમય વર્તના થાય.

જીવનું લક્ષણ છે ઉપયોગ. આ ઉપયોગની ગેરહાજરી એટલે પ્રમાદ. જેવું “મારે થી થવું હેરાન” આ જ્ઞાનના ઉપયોગમાં આવે એટલે અંદરથી પ્રજ્ઞા વિવેક જાગે. “મારે નથી થવું હેરાન” એ સમ્યક્ જ્ઞાન થયું અને જેવું સમ્યક્ જ્ઞાન થાય એટલે જગત જેવું છે એવું દેખાવાની શરૂઆત થાય.

“તું નિર્દોષ હું નિર્દોષ માત્ર મારી દ્રષ્ટિમાં દોષ” આ સૂત્રથી આપણી અંદર verify કરવાનું, આમ સમ્યક્ ચારિત્ર ઉભું થાય.

ઔદ્યોગિક ભાવથી ગમા અને અણાગમાનો દોષ થાય છે એ temporary ચિત્તમાં રહે છે. એ ગ્રહિત થઈ જાય, મોહથી ખોવાઈ જઈએ તો



પાછો multiply થઈને કાર્મણા hard disk માં store થઈ જાય. આ મોટી ભૂલ થઈ જાય. આ ભૂલ ન થાય એટલે ભગવાને પ્રતિકમણ દ્વારા ચિત્તની શુદ્ધિનું નિયોજન બતાવું.

“મારે નથી થવું હેરાન” એવી જાગૃતિ થાય એટલે ઉદાહિક ભાવે કર્મની અસર data થઈ જાય. આને કષય કહેવાય. “મારે નથી થવું હેરાન” માં તરીકે action ન આવે, એક કણ અટકી જાય એ અટકવું એનું નામ ઉપશમ. આ ઉપશમમાં જાગૃત રહીએ એટલે કષય થાય. કમ ઉપશમ પછી કષયનો છે.

આ રીતની આંતરિક chemistry છે.

અત્યાર સુધી આપણી બુધ્ધિએ ભગવાનને ઓળખવા ન દીધા. એવા બુધ્ધિમાં રહેલા data સાફ થઈ રહ્યા છે.

અને સમ્યક્ દ્રષ્ટિના data અંદર ભરાઈ રહ્યા છે. બુધ્ધિમાં limited જગ્યા છે. જે મિથ્યા દ્રષ્ટિએ ભરી દીધી છે. એ મિથ્યા દ્રષ્ટિની જગ્યા હવે સમ્યક્ દ્રષ્ટિના data લઈ રહ્યા છે એટલે એ જ બુધ્ધિ વિવેક વાળી બને. આવા વિવેકનું સાતત્ય જળવાય એટલે અંદર પ્રકા પ્રગટ થાય. પતંજલી ઋષિએ કહ્યું ઋતું ભરા અવસ્થા ઉભી થાય. આ પરાની દશા છે.

આ જગતનું સ્વરૂપ સાત્ત્વિક રીતે કેવું છે એ જાણવું meta physics છે. આ જગત જીવ અને અજીવથી બને લું છે. જીવનલું લક્ષણ ‘ઉપયોગ’. આ લક્ષણ દ્વારા જ આપણો અંદર input કરીએ. “મારે નથી થવું હેરાન” એ ઉપયોગમાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ થાય, જોવું, જાણવું, અનુભવવું એ પ્રકારનું થાય એ જ પ્રકારનું દર્શન અને જ્ઞાન શુદ્ધ થાય.

દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ગુણ છે પણ જીવનું લક્ષણ ‘ઉપયોગ’ છે. આ સદઉપયોગ સૂચિમાં માત્ર મનુષ્ય કરી શકે છે. આ ઉપયોગ મૂકી શકે, અમલ કરી શકે, result ઉભું કરી શકે, પ્રગટ કરી શકે એવી એની સ્વતંત્રતા છે.

### મોહ થવાનું નિમિત્ત કોણા છે ?

આ જીવ જેના કારણે મોહિત થાય છે એને ઓળખવો પડશો, મોહ થવાનું નિમિત્ત કોણા છે ?

જડછે, સ્વરૂપ છે. જડ જ્યારે મોહના રસથી સિંચાઈ સ્વરૂપ ધારણ કરે ત્યારે મમત્વ ઉભુ થાય એટલે આપણો રવાડે લાગી જઈએ. દ્રષ્ટિનો દોષ પ્રતિકમણ દ્વારા વારંવાર સાફ કરવો પડે, જો તત્વ દ્રષ્ટિ આવી જાય તો પ્રતિકમણાની જરૂર ન પડે. એકવાર દ્રવ્યને જાણીએ એટલે દ્રવ્યના જાણવાપણાથી ચિંતન દ્રવ્યાત્મક થઈ જાય, scientist વાળું બની જાય, જેવી

દ્રષ્ટિ scientist બને એટલે આપણનું કામ થઈ ગયું.

આ જીવની અંદર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અસ્તિકાય, કાળ અને પુદ્ગલ છે. આ પાંચને અજીવ કષય કારણ કે એનામાં જોયા જાણવાની capacity નથી.

મૂળભૂત આકાશ જીવ અને અજીવને જગ્યા આપે. આકાશ single છે, અખંડાત્મક છે. એના દુકડા થઈ શકતા નથી એ એના ગુણ છે. આ space વગર જીવ અને અજીવનો સંબંધ અશક્ય છે.

આ જીવ ગતિ કરે છે. આ ગતિમાં જે supply કરે એ ધર્મ. આ ગતિમાં રૂકાવટ ઉભી કરી શકાય એનું નામ અધર્મ. એક એવી શક્તિ છે જે movement માં સહાયક બને છે અને એક એવી energy છે જે સ્વિર થવામાં સહાયક છે. જેવી movement ની વાત આવે એટલે સમયની વાત સાથે જોડાયેલી રહે એને કાળ કષ્ટો. આકાશ અને કાળ બને related છે. કોઈને પણ કોઈની સાથે જોડાડા કરવું હોય તો આ ચારની જરૂરત છે.

### પુદ્ગલ એટલે શું ?

આપણો પુદ્ગલથી બનેલા છીએ. પુદ્ગ એટલે ભેગું થવું અને ગલ એટલે વિભેરાઈ જવું. બસ આ યાદ રાખવાનું છે. આ ભૂલી જઈએ એટલે દુઃખ થાય છે. ઉપયોગમાં એ નથી કે જેનું પુરણ છે એનું ગલન પણ છે. આ ભૂલી જવું એનું નામ ‘પ્રમાદ’.

જોવું, જાણવું આપણી capacity માં છે પણ હકીકિતમાં જોઈને જાણીએ છીએ શું ? કોનું જાણો છો ?

પુદ્ગલનું.

મોહ, પુદ્ગલના સ્વરૂપની અંદર થાય છે. એનું નિમિત્ત પુદ્ગલ છે. પુદ્ગલ એ અમૃત નથી મૃત છે, ગલન અવશ્ય થવાનું છે. દ્રષ્ટિમાં હવે આવું પુદ્ગલ નાખવાનું છે. આ ભૂલી જવાય છે ત્યારે દુઃખ ઉભુ થાય. આ જ દ્રષ્ટિનો દોષ છે.

પુદ્ગલનો પહેલો ગુણ ભેગું થવું અને વિભરાવવું. આ ભેગું થવાનો પુદ્ગલનો સ્વભાવ છે. ચેતન એ માત્ર ત્યાં નિમિત્ત રૂપે હાજર છે. પણ પુદ્ગલ પોતે કામ કરે છે. પુદ્ગલનું કામ ચેતન ન કરી શકે અને ચેતનનું કામ પુદ્ગલ ન કરી શકે. ચેતન આ પાંચેમાંથી કોઈનું કામ ન કરી શકે. આ પાંચે પણ એકબીજાનું કામ ન કરી શકે, એકબીજાના field માં enter ન થાય. આ એમનો મૂળભૂત સ્વભાવ છે પણ મદદ એકબીજાને કરે.

શુભેચ્છા :

‘





“તું કોઈનો કર્તા નથી, તું તારા મૂળ સ્વભાવનો કર્તા સિવાય બીજા કોઈનો કર્તા નથી” આ વૈજ્ઞાનિક view point છે. જે તત્ત્વમાં હોય એ જગતમાં દેખાય. જે મૂળમાં હોય તે બહાર દેખાય. મૂળમાં છે પોતાના સ્વભાવનું કર્તાપણું. પરભાવનું કર્તાપણું નથી.

ચેનત પુદ્ગલનું ન કાંઈ કરી શકે, ન પુદ્ગલ ચેતનનું કાંઈ કરી શકે. એકબીજાના support માં અહોભાવમાં હોય, એકબીજાની હાજરીનો ઉપયોગ લઈને પોતપોતાનું કામ કરતા હોય એટલે બધું નિર્માણ થઈ જાય.

પુદ્ગલનો મૂળભૂત અંશ પરમાણુ છે. આ પરમાણુની સ્વતંત્રતા છે ભેગુથવું અને વિભેરાઈ જવું. એનું નિમિત્ત બીજા બની શકે છે. આ પરમાણુમાં સ્વયંની ગતિ છે અને એ જ શક્તિ છે, એ જ તરંગ છે. એ જ vibration છે. ચેતનનો ગુણ તરંગ નથી. એ પોતે નિસ્તરંગ છે. પુદ્ગલ એની સાથે ભળી ગયો છે એટલે તરંગ દેખાય છે. અજાણતામાં આપણો એ તરંગને ગોત્યા કરીએ જે સૂક્ષ્મ રૂપે મોહ છે. આ પરમાણુનો, જડનો, પુદ્ગલનો મોહ છે.

## ભગવાનની પાસે જઈ માંગીએ શું?

તરંગ.

એના તરંગ એવા છે જે માત્ર હિત જ કરશે, એટલે unwanted તરંગ બધા નીકળી જાય. બસ એનાજ તરંગ રહે એટલે એની હાજરી આપણાને મળે. આનંદ આનંદ વર્તાય, અને સહજ સ્વરૂપે વગર મહેનતે આપણી અંદર પ્રગટે. આ તરંગોને બુધ્યિ દ્વારા ગોતવાની કોશિશ નથી કરવાની. એમ કરશું તો એની પાછળ મોહ ઘુસી જશે.

અત્યારે આપણો પરમાણુવાળા છીએ. અંત:કરણને શુદ્ધ કરવું છે માટે ત્યાં સુધી તરંગની જરૂર છે. આપણી બુધ્યિમાં એમના તરંગ ભરી દઈએ એટલે સદભુધ્યિ, વિવેક બુધ્યિ, પ્રજ્ઞા બુધ્યિ બની જાય. જેવા સહજ બનીએ એટલે શબ્દો નીકળે, કાઢવા ન પડે. જેવું સહજ નીકળે એટલે સમજવું કે મારુ tuning થઈ ગયું છે. જ્યાં સુધી સહજ નથી નીકળતુ, સમજવું કે બુધ્યિનો ડખો છે. આ સમજવું એનું નામ વિજ્ઞાન, આની જાગૃતિ સ્વયંને એનું નામ વિજ્ઞાન. સ્વયંને સ્વયં દ્વારા જોવાની આ પ્રક્રિયા એનું નામ scientific દ્રષ્ટિ. આ જ જ્ઞાનાત્મક ભક્તિ છે. જ્યાં સુધી સહજ સ્રૂત નથી નીકળતું તો સમજવું કે આપણો એમની નિશામાં નથી. આ આપણા માટે inspection નું લક્ષણ છે. આપણો સંબંધ અજ્ઞવ સાથે કેવો છે એના સુધારા માટે દ્રવ્યાનુંયોગ છે. ચેતન અને પુદ્ગલનો સંબંધ અથ્યાર સુધી કેવો છે એ આપણો જાણતા ન હતા, પણ

જેવી જેવી સંબંધમાં શુદ્ધિ આવશે એટલે દ્રષ્ટિમાં જે દોષ આવે છે તે સાફ થઈ જશે.

## “ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ”

દ્રવ્ય એટલે ગુણાનો સમૂહ. દ્રવ્ય એને કહેવાય જેની અંદર ઉત્પાદ થાય છે. વ્યય થાય છે, અને center માં પોતે જેમ છે એમ રહે છે. પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે.

હે અરિહંત પરમાત્મા,

આ દ્રવ્યાનુંયોગ ચિંતનથી એવો નિર્જર્ષ ઉપર આવ્યો છું કે હું ચેતન છું, નિરંજન નિરાકાર અનંત શક્તિવાળો છું અને જોવું, જાણવું એ જ મારુ અનંત સુખ છે, એ જ મારો અનુભવ છે, એ જ મારો સ્વભાવ છે, પણ જોવા જાણવાની અંદર નોહ નામના રસથી આ પુદ્ગલ સાથે જોડાણ કરી લઉં છું, જેનો સ્વભાવ છે ખતમ થવું, જેનો સ્વભાવ છે પુરણ થવું એની અંદર મોહ કરી પોતાને ખતમ કરું છું. હું ખરેખર અજર છું, અમર છું, અવિનાશી છું. મારુ આ જોડાણ થવાથી અજર માંથી જર, અમર માંથી ભર, અવિનાશી માંથી વિનાશી બની જાઉં છું. આ જ મારી ભૂલ છે. મારો કોઈ જન્મ નથી, મારું કોઈ મૃત્યુ નથી. મૃત્યુ તો પુદ્ગલનું થાય છે પણ પુદ્ગલના જોડાણથી મારો જન્મ અને મૃત્યુ સમજું છું. અને દુઃખ અને સુખના અનુભવ કરું છું. આ જ મારું મિથ્યા જ્ઞાન છે, આ જ મારી મિથ્યા સમજ છે.

હે પ્રભુ,

આ તત્વ ચિંતન મારી અંદર સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન ઉલ્લ કરી રહ્યું છે એવું મને લાગે છે. જગતને જોવાનું આજે મને નવીન સ્વરૂપ મળ્યું છે. આ તત્વ સ્વરૂપની અંદર હું સ્થિર થાઉં અને એ જ દ્રષ્ટિએ જોવાનો હું નિર્ણય કરું છું. જેથી કરીને મને હવે બરાબર ખબર પડી ગઈ છે. જો આ તત્વ દ્રષ્ટિ મારી અંદર પ્રગટ થશે અને સ્થિર થશે તો દ્રષ્ટિનો દોષ ઉભો નહીં થાય. મારે આ કાર્ય કરું છે, એની અંદર સ્થિર થવું છે. આ તત્વ દ્રષ્ટિ એ જ સમ્યક દ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિની અંદર સ્થિર, અચલ અને અમર થવું છે. મોહના કારણો વારંવાર ચલિત ન થાઉં, કર્મના આવેગના કારણો હું એની અંદર ખોવાઈ જાઉં છું. બસ આપણી આ જે તત્વ દ્રષ્ટિ છે એ મને હવે કોઈ દિવસ ખોવાવા ન હે, મારી આ દ્રષ્ટિ જાગૃત રહે, અપ્રમત રહે એ જ આપને વિનંતી... (૩).

નમો જિણાણં.



શુભેચ્છાક :

૨





## ૧. ઉપાધ્યાય પદના ગુણો શું શું છે ?

૨. સરળ, સહજ, સજગ આ ગ્રાણ ભક્તના ગુણ છે, વિનય અને વિવેક આમ પાંચ મૂળભૂત ગુણ ઉપાધ્યાયના છે. આ પાંચ ગુણ જેમાં હોય એનું જ નામ ઉપાધ્યાય. (જે સત્તસંગી હોય એમાં 20% ભક્તતા હોવી જોઈએ) વિનયમાં ચાર step છે. નમન, શરણ, સમર્પણ, આત્મસમર્પણ. આ ગુણ છે, કોઈ વ્યક્તિમાં સાધુ, ઉપાધ્યાય શોધવાના નથી. જો એમ કરશું તો ગોથા ખાશું.

આપણો શા માટે ગુણ જાપ કરીએ છીએ ? કેમ કોઈ individual નું નથી કરતા ? ભગવાને સ્વયં કેમ આ રીતે બતાવ્યુ, કારણકે વ્યક્તિ જ્યાં સુધી કેવળીન થાય ત્યાં સુધી incomplete છે, અને ત્યાં સુધી આપણા જીવા બાળજીવની દ્રષ્ટિ અવગુણ ઉપર જાય અને આપણો આવવાનું છે ગુણ ઉપર. આપણી આદત છે અવગુણ જોવાની. એ આદતને લીધે હેરાન થવાય છે. આમાંથી બહાર નીકળવું હોય તો એકજ રસ્તો છે કે પહેલેથી habit pattern ગુણાત્મક કરવાની.

ગુણાત્મક habit pattern હશે તો જે પણ વ્યક્તિ-વસ્તુ, પરિસ્થિતિ સામે આવશે એમાં ગુણજ દેખાશે. સ્ત્રી કે પુરુષ સુધ્યા નહિ દેખાય. આપણો બહારના સ્વરૂપને જોવા ટેવાયેલા છીએ એટલે એમાં ખોવાઈ જવાય છે. આ જોવાની પદ્ધતિમાં પણ આપણો સ્ત્રી અને પુરુષ એમ બે ભાગ કરીએ. આગળ એમાં આપણો reference point પાછલા ઈતિહાસમાં જાય, નજીક કે દૂરના સંબંધ ઉપર જાય. જો આમજ કરશું તો ક્યારે પણ આપણો આપણા ઉપર આવશું જ નહિ, સંભવ જ નથી.

આ આદત, આપણાને પૂર્વ સંસ્કારોમાંથી આવી, જેમાં એક અત્યારના, અને એક પહેલાના છે. અત્યાર સુધી જે વાતાવરણ આપણાને મળેલું છે એ પૂર્વકર્મને લીધે છે, અને એને કારણો આપણા માનસમાં એક data નો જથ્થો ભેગો થયો છે. આ માનસમાં લાગણીનું કેન્દ્ર અને વિચારનું કેન્દ્ર એમ બે વસ્તુ આવેલી છે. બુધ્ધિનું કામ છે લાગણીને માર્ગદર્શન આપવું. આપણા જીવનમાં જેટલા લાગણીઓના તોફાન છે એ બુધ્ધિ પ્રેરિત છે, લાગણી તો બિચારી એની બહેનપણી છે. આ બુધ્ધિને માર્ગદર્શન ચિત્ત આપે છે. આ ચિત્ત જ પૂર્વકર્મનું reflection છે. બુધ્ધિ અને મન તો ચિત્તના faithful નોકર છે.

ચિત્તની અંદર જ્ઞાન power અને કર્મ power છે એટલે શુધ્ય આત્માનો

પ્રકાશ અને કાર્મણા વર્ગણાની મસ્તી હાજર છે. ચિત્ત is combination of કર્મનો પ્રભાવ અને જ્ઞાનસત્તાનો પ્રભાવ, આમા જે જીતે એવું પરિણામ આવે, આમ મનુષ્યને છોડીને બધામાં કર્મ સત્તા ચાલે છે, માટે જ જગત આખું automatic ચાલે છે.

જ્ઞાનસત્તાને બહાર આવવાનો મોકો કયારે મળે ?

સજગતા એ જ્ઞાનને ઉઘાડવાનો દરવાજો છે અને “મારે નથી થવું હેરાન” એ મંત્ર. આ મંત્રના ઉપયોગથી જ જ્ઞાનના દરવાજા ઉઘડશે નહિ તો મનુષ્ય હોવા છતા આપણો કર્મસત્તાના ગુલામ થઈને રહીશું.

મનુષ્ય પણ 80% કર્મસત્તાથી control છે. 20% નું option છે અને આ 20% option ના પટારાને ઉઘાડવા માટેનો મહામંત્ર છે. ‘મારે નથી થવું હેરાન’ આ મંત્ર જ આપણાને જ્ઞાનસત્તામાં લાવી શકશે, બાકી આ જગતમાં બીજો કોઈ મંત્ર નથી જે જ્ઞાનસત્તામાં લાવી શકે, કારણકે આ મંત્ર ભગવાને આપ્યો છે અને આપણાની લાયકાત જોઈને આપ્યો છે.

ઉપાધ્યાય પદના ગુણ એ જ્ઞાન સત્તાનો વિકાસ છે.

જ્ઞાન સત્તાનો વિકાસ એટલે પાંચ ગુણ. સરળતા, સહજતા, સજગતા, વિનય અને વિવેક. વિનયમાં અન્ય ચાર step નમન, શરણ, સમર્પણ અને આત્મસમર્પણ.

નમન એટલે વ્યક્તિ-વસ્તુ-પરિસ્થિતિ, જે પણ આપણા સંપર્કમાં આવે એના ગુણોનો સ્વીકાર ભાવ. નમનમાં પહેલા અહોભાવ થાય. અહીં નમનનું કાર્ય પૂરુ થાય. અહોભાવ થાય એટલે implementation ની શરૂઆત થાય. આ શરૂઆત થવી એજ શરણ છે.

શરણ વગર આ જગતમાં Real Result જ્ઞાનાત્મક પરિણામ શક્ય જ નથી. કર્મસત્તામાંથી બહાર નીકળવું હોય તો ભગવાને શરણનો માર્ગ બતાડ્યો. આ શરણ સ્વયં નહિ આવે એમાં પહેલા નમન આવશે. વગર નમનનું શરણ કામનું નથી, અને શરણ નથી તો માર્ગ અટકી ગયો. બસ આપણા life માં આવું જ થાય છે.

આવા અટકણમાંથી બહાર નીકળવાનું છે એના માટે આપણો advance ગુરુ ઉપાધ્યાય પદને પકડીએ છે, જેમાં નમનવાળું શરણ અને અહોભાવથી implementation છે.

“અહોહો મન જે માર્ગ મળ્યો છે બસ એજ perfect છે એનું હું implementation કરું છું.” અંદરનો ભાવ implement કરવાનો

શુભેચ્છા :

૨





છે. બહારથી થતું નથી એ અલગ વસ્તુ છે પડા અંદર પૂર્ણ અહોભાવ ભરેલો હોય એનું નામ શરણ.

Now my first priority is this because this is heart of every thing. મારા આખા જીવનનો વિકાસ, મારા આખા અસ્તિત્વનો વિકાસ આના ઉપર છે. જો એને પ્રાધાન્યતા નહિ આપું તો કામ કેવી રીતે થશે. મારી journey નું fundamental foundation આ છે. હવે એને સમર્પિત નહિ થાવ તો result આવવાનું નથી.

સમર્પણમાં કોણ આવે અને શરણમાં કોણ અટકે? શરણ અને સમર્પણ વચ્ચે ભેદ શું? કયારે સમજવું કે સમર્પણ આવ્યું? એનું લક્ષણ શું? શરણ અને સમર્પણ વચ્ચેનો ભેદ તાલાવેલી છે. જો તાલાવેલી આવી તો સમર્પણ છે સમજવું આ એનું લક્ષણ છે. જો તાલાવેલી છે તો સમર્પણની સંભવના છે અને આવી તાલાવેલીવાળું implementation થાય તો આત્મસમર્પણ થાય.

ઉપાધ્યાય પદમાં આ ચારે વસ્તુ હાજર છે.

સરળતા એટલે Total transparency, કાઈ છુપાવવું નહિ. બોલવું-વિચારવું અને અમલ કરવું આ ગ્રંથોની unity છે. ગ્રંથો એક સરખા હોય આજ સરળતા છે.

સહજ એટલે એકદમ easy. જે થાય છે એનો સ્વીકારભાવ. જેવો સ્વીકાર કરશું એજ સમર્પણ. જેવું સમર્પણ કરશું એટલે એમાંથી સર્જન થશે. જો સ્વીકાર નહિ કરીએ અને એની સાથે fight કરશું તો solution ક્યાંથી આવશે? સર્જન એજ solution છે. પડા એ સર્જનશક્તિ ત્યારે બહાર આવશે જ્યારે આપણો નિભિતનો સ્વીકાર કરી લઈશું. Now what next? એમ વિચાર કરશું તો સર્જન આવશે. આવી વિચારવાની પ્રેરણાનું બળ ઉપાધ્યાય પદ આપે.

આ આખો સાધનાનો માર્ગ છે. યોગની અંદર બહુ clear cut કહ્યું છે કે યથાર્થનો સ્વીકાર, વ્યથાર્થ નો બાદ, તો જ ગીતાર્થમાં અવાશે, અને ગીતાર્થમાંથી પરમાર્થ પ્રાપ્તિ છે. આ આખો અમલનો રસ્તો છે. અમલ છે તો રસ્તો ચાલુ થાય છે નહિ તો everything is બકવાસ.

સમર્પણ બે રીતે આવે, એક જ્ઞાન સત્તાથી આવે અને એક કર્મ સત્તાથી આવે. આ બન્ને સત્તા સતત parallel ચાલુ છે. આમાં આપણો જગૃત રહેવાનું છે કે આ જ્ઞાન સત્તાથી આવ્યું કે કર્મ સત્તાથી. જ્ઞાન સત્તા હાજર

રહેશે તો એ આપણાને પડવા નહિ દે અને એનું જ નામ સજગતા. આવું જગૃત ધ્યાન કરવા માટે ભગવાને simple મહામંત્ર આય્યો “મારે નથી થવું હેરાન”. જ્ઞાન સત્તાને ઉજાગર કરવા માટેની આ ચાવી છે. સરળ, સહજ, સજગ અને વિનય આ ચાર હોય તો વિવેક automatic આવે. વિવેક એ બુદ્ધિનો ગુણ છે અને જેની બુદ્ધિ સંપૂર્ણ વિકાસવાળી છે એનું નામ વિવેક. વિકાસમાં આ ચાર વસ્તુ હાજર છે અને આ ચાર ગુણ જેનામાં હાજર હોય એજ વિવેકી બુદ્ધિ. આખો યોગ માર્ગ પહેલા attack કરે છે વિવેકની જગૃતિ ઉપર.

અભ્યાસ માર્ગમાં પહેલા શ્રદ્ધા ઉભી કરવાનું કહ્યું. આ શ્રદ્ધા પોતાના અનુભવથી ઉભી કરવાની છે. એનાથી awareness આવે, જાગૃતિ આવે. આપણાથી કેટલું અમલ થાય છે, કેટલું implementation થાય છે, એના ઉપર ધ્યાન રાખવાનું છે. આ આખો માર્ગ આશાનો છે. નિરાશાનો નથી. શું નથી થતું એના ઉપર ધ્યાન છે જ નહિ, શું થઈ રહ્યું છે એના ઉપર ધ્યાન કરવાનું છે, શું મેળવ્યું એના ઉપર ધ્યાન કરવાનું છે. જે નથી એના ઉપર ચિંતા નથી કરવાની, જે છે એનું ચિંતન કરવાનું છે. ચિંતામાંથી ચિંતનમાં conversion કરવાનું છે. જે છે એમાં કેવી રીતે આગળ વિકાસ કરવો એનું ચિંતન, એની અંદર સતત પુરુષાર્થ, શ્રમ, મહેનત એનું નામ સાધુ. જે ચિંતા કરે એ સાધુ છે જ નહિ જે ચિંતનમાં છે એનું નામ સાધુ.

યોગ અભ્યાસમાં પહેલી શ્રદ્ધા કહી, બીજી વિર્ય કહ્યું and its a fruit of શ્રદ્ધા. આ શંકા રહિતનું જે બળ છે એ વિર્યબળ. આવું શ્રદ્ધા સહિતનું વિર્યબળ ઉભુ થાય એમાં જ્ઞાન સત્તા જોડવાની છે એનું નામ સ્મૃતિ. શ્રદ્ધા અને જ્ઞાનસત્તાની જગૃતિ, બસે ભેગા થાય એટલે એટમબોબ જેવી શક્તિ નીકળશે. એ આપણાને સતત વિવેકમાં રહેવાનીપ્રેરણા આપશે.

વિવેક is nothing but ગુરુ, but this વિવેક is our own એટલે અંતરગુરુ. બહારના ગુરુને વારંવાર ક્યાં સુધી શોધશો, જે યથાર્થ છે Real છે એની સાથે વારંવાર સંગ કરશું એજ વિવેક ઉભો કરશે. સતનો (Real) ગુરુ એજ સદગુરુ. જે યથાર્થની સાથે વારંવાર જોડે એનું નામ સદગુરુ. જે આપણો વિજિતરૂપે લઈએ છે it is only a external factor, બાકી એનો roll છે આપણી અંદર વિવેક ઉભો કરવો.

આપણી અંદર already દિવડો છે, ખાલી એને ignition કરવાની જરૂર

શુભેચ્છા :

૨



છે. આપણી અંદર જ્ઞાનનો દિપક છે એમાં light કરવાની છે. પ્રકાશ એમાંથી ઉભો થશે. સ્વયંના પ્રકાશમાંથી ઉભો થશે.

બે-બે મિનિટ સરળતા, સહજતા, સજગતા, વિનય, વિવેક આ ગુણોનો જ્ઞાપ કરશું. આ બધા આંતરગુણો છે અને જેમાં આનો વિકાસ થયો છે એવા ઉપાધ્યાય પદનો આપણો જ્ઞાપ કરશું, એટલે એવી સરળતા, સહજતા, સજગતા, વિનય આપણી અંદર પ્રગટ થાય, એવી ભાવના કરશું. એવા વિવેકનો વિકાસ મારી અંદર પ્રગટ થાય, એવી મારી બુધ્યિ વિવેકી થાય એવો ભાવ પ્રગટ કરશું.

જેની અંદર આવો વિકાસ થશે એ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનો માર્ગ કાઢી લેશે.

## ૨. અહંકાર શું છે ?

૩. અહંકાર is one of the element. અહંકાર એટલે હું છુ, મારુ છે, પ્રમોદપણુ. For Ex. પ્રમોદભાઈની વાત કરીએ. ખરેખર પ્રમોદ is not પ્રમોદ. પ્રમોદની અંદર જે છે એને પ્રમોદ સાથે કોઈ લેવાડેવા નથી પણ અત્યારના પ્રમોદની સમજમાં I am પ્રમોદ છે. પ્રમોદને કંઈ થાય તો disturb થવાય છે. આ જે disturbance છે એનું નામ અહંકાર. Body માંથી જે પ્રમોદપણુ ઉભુ થાય છે એનું નામ અહંકાર, because body is not પ્રમોદ, neither innerself is પ્રમોદ પણ આ બન્ને ને જે જોડે છે that is અહંકાર.

‘મારે નથી થવું હેરાન’ એ મંત્રને જગાડવા માટેનો મંત્ર છે ‘નમો જિજ્ઞાણાં’. સવારની-રાતની પ્રક્રિયાથી રોજ hitting થાય પરંતુ એ ૨૪ કલાક નથી થઈ શકતી. Hitting થવું એટલે ધીમે ધીમે આદત develop થવી. પહાડો ઉપરથી વહેતા ઝરણાઓમાં વરસાદનું પાણી વહે છે. ઝરણું જ્યારે સૂકાઈ જાય છે તો પણ પાછળ પોતાના વહેણાની નિશાની મૂકુતું જાય છે. વળી પાછુ જ્યારે વરસાદનું પાણી આવે તો automatic પાણી એજ રસ્તો પકડે. બસ આવી જાતની ઘટના આપણા ચિત્તની ભૂમિની અંદર થાય છે. મારે નથી થવું હેરાનનું સતત રટણા, સવારની-રાતની પ્રક્રિયાની અસર ઝરણાના વહેણ જેવી થાય છે. ઝરણાની ગેરહાજરીમાં વહેણ તો ત્યાંજ રહે એજ પ્રકારે સતત મંત્રના hitting કરવાથી energy અંદર store થતી રહે. આ ભાવ, ઉદ્યને

કાર્યવંત થવાન હૈ.

મારે નથી થવું હેરાન સતત યાદ રાખવા, આ જગૃતિ દ્વારા હેરાનગતિ ઓછી ઓછી થતી જાય. જેમ જેમ હેરાનગતિ ઓછી થતી જાય તેમ તેમ અંદરથી આનંદનો ફૂવારો સતત વહેતો રહે. આચાર્યનું પદ આજ ભજાનાંદનું પદ છે. બ્રહ્મ એટલે ઉચ્ચ પ્રકારનો શુદ્ધ આનંદ.

**બ્રહ્મચર્ય એટલે શું ?**

જે હંમેશા આનંદની અંદર વહ્યા કરે એનું નામ બ્રહ્મચર્ય. બ્રહ્મ એ આનંદનો અનુભવ છે. આચાર્ય એટલે સદા એ આનંદમાં વર્ત, વહ્યા કરે એમનું ચિત્ત હંમેશા પ્રસન્ન હોય. એમનું ચિત્ત પ્રસન્ન એટલા માટે હોય કારણકે fully charged હોય. ચિત્ત એમનું જ પ્રસન્ન હોય જે સહજરૂપે, વગર મહેનતે સતત મારે નથી થવું હેરાનના વહેણમાં હોય, અને આ મહેનત ચિત્તમાં આંકો-slot-groove ન બને ત્યાં સુધી કરવાની છે. એકવાર આંકો બની જાય એટલે મારે નથી થવું હેરાનનું વહેણ એમાંથી જ વહેવાનું. બસ આજ મહેનત કરવાની છે. આવી મહેનત કરી નથી એટલે difficult લાગે છે. આનંદમાં રહેવું વધારે સહેલું છે, જંગટમાં રહેવું વધારે difficult છે. પાંચ મિનિટ પહેલા જેને આપણો મજા હોઈએ તે તે નથી અને હું એ હું નથી કારણકે સતત નિરંતર અંદર નવું નિર્માણ થઈ રહ્યું છે. આપણા આખા અસ્તિત્વનું connection શાસ સાથે છે, દરેક શાસે આપણાં અસ્તિત્વ change થાય છે. આપણો problem છે આપણો જુનાને પકડી રાખીએ છીએ, નવું દેખાતું નથી.

આંખ બંધ કરી શાસની પ્રક્રિયા કરવી. એકદમ ઉંડો શાસ લેવો એકદમ ઉંડો શાસ છોડવો. આ શાસ લેવાની ગતીને gradually speedup કરવી. આમ પાંચ મીનિટ કરવું.

હવે શાંત થઈ જુવો... મસ્તિષ્ણથી શરૂ કરો. બે મિનિટ પહેલા જે મસ્તક હતું તે change થતું દેખાશે. દરેક રોમમાં એક પ્રક્રિયા ચાલુ છે. દેખાશે... અનુભવ થશે... નવું શરીર બની રહ્યું છે, મરેલા cell બહાર ફેંકાઈ રહ્યા છે. નવી ઉર્જા આવી એમાંથી નવા cell ઉભા થાય છે. નવો આણું ઉભો થાય છે. નવા આણુના જથ્થાથી નવું શરીર ઉભુ થાય છે. કોઈપણ શરીરના એક ભાગને જુઓ... જ્યાં વધારે ચેતના લાગતી હોય ત્યાં જુઓ.. બે મિનિટ એકદમ શાંતિ જાળવો.

ધીમેથી આંખો ખોલવી.





## ॐ કે 11 શારીરિક લાભ



ॐ અર્થાત् ઓદમ્ તીન અક્ષરોં સે બના હૈ, જો સર્વ વિદિત હૈ ।  
અદમ્ ।....

“અ” કા અર્થ હૈ ઉત્પન્ન હોના, “ઉ” કા તાત્પર્ય હૈ ઉઠના, ઉફના અર્થાત् વિકાસ, “મ” કા મતલબ હૈ મૌન હો જાના અર્થાત् ‘‘બ્રહ્મલીન’’ હો જાના ।

ॐ સમ્પૂર્ણ બ્રહ્માણ કી ઉત્પત્તિ ઔર પૂરી સૃષ્ટિ કા ઘોતક હૈ । ॐ કા ઉચ્ચારણ શારીરિક લાભ પ્રદાન કરતા હૈ ।

જાને, ..... ॐ કેસે સ્વાસ્થ્યવર્ધક ઔર અપનાએં આરોગ્ય કે લિએ માત્ર ॐ કે ઉચ્ચારણ કા માર્ગ.....

૧. ॐ દૂર કરે તનાવ : અનેક બાર ॐ કા ઉચ્ચારણ કરને સે પૂરા શરીર તનાવ-રહિત હો જાતા હૈ ।
૨. ॐ ઔર ઘબરાહટ : અગર આપકો ઘબરાહટ કા યા ધધીરતા હોતી હૈ તો ॐ કે ઉચ્ચારણ સે ઉત્તમ કુછ ભી નહીં ।
૩. ॐ ઔર તનાવ : યા શરીર કે વિષેલે તત્વોં કો દૂર કરતા હૈ, અર્થાત્ તનાવ કે કારણ પૈદા હોને વાલે દ્રવ્યોં પર નિયંત્રણ કરતા હૈ ।
૪. ॐ ઔર ખૂન કા પ્રવાહ : યા હૃદય ઔર ખૂન કે પ્રવાહ કો સંતુલિત રખતા હૈ ।
૫. ॐ ઔર પાચન : ॐ કે ઉચ્ચારણ સે પાચન શક્તિ તેજ હોતી હૈ ।
૬. ॐ લાએ સ્ફૂર્તિ : ઇસસે શરીર મેં ફિર સે યુવાવસ્થા વાલી સ્ફૂર્તિ કા સંચાર હોતા હૈ ।
૭. ॐ ઔર થકાન : થકાન સે બચાને કે લિએ ઇસસે ઉત્તમ ઉપાય કુછ ઔર નહીં ।
૮. ॐ ઔર નીંદ : નીંદ ન આને કી સમસ્યા ઇસસે કુછ હી સમય મેં દૂર હો જાતી હૈ । રાતો કો સોતે સમય નીંદ આને તક મન મેં ઇસકો કરને સે નિશ્ચિત નીંદ આએણી ।
૯. ॐ ઔર ફેફડે : કુછ વિશેષ પ્રાણાયામ કે સાથ ઇસે કરને સે ફેફડોં મેં મજબૂતી આતી હૈ ।
૧૦. ॐ ઔર રીઢ્ઝકી હફ્ઝી : ॐ કે પહલે શબ્દ કા ઉચ્ચારણ કરને સે કંપન પૈદા હોતી હૈ । ઇન કંપન સે રીઢ્ઝકી હફ્ઝી પ્રભાવિત હોતી હૈ ઔર ઇસકી ક્ષમતા બઢ્યાતી હૈ ।
૧૧. ॐ ઔર થાયરાયડ : ॐ કે દૂસરે અક્ષર કા ઉચ્ચારણ કરને સે ગલે મેં કંપન પૈદા હોતી હૈ જો કિ થાયરાયડ ગંધિ પર પ્રભાવ ડાલતા હૈ ।

શુભેચ્છાક :

અંક : ૨૬ / ઓક્ટોબર-૨૦૧૪

## ઉષાપાન કા ચમત્કારી લાભ (Water Therapy)

આપને ઉષાપાન કા નામ તો સુના હોગા ? ઉષાપાન કા અર્થ હૈ પ્રાતઃ ઉષાકાળ મેં સૂર્ય નિકલને સે પહલે હી પાની પીના । યા પાની રાત કો તામ્બે કે બર્તન મેં ભરકર કિસી લકડી કે પટરે પર રખ દે ઔર સુબહ ઉઠતે હી બિના કુલા કિએ કમ સે કમ દો ગિલાસ પાની પી જાએં ।

ઉષાપાન કે કર્ફી સોપાન હૈ —

- ૧) પાની રાત કો તામ્બે કે બર્તન મેં રખના ચાહિએ ।
- ૨) પાની કા બર્તન કિસી લકડી કે પટરે પર રખના ચાહિએ ।
- ૩) પાની સૂર્યોદય સે પહલે પીના ચાહિએ ।
- ૪) પાની બિના કુલા કિએ હી પીના ચાહિએ ।
- ૫) પાની કમ સે કમ દો ગિલાસ હોના ચાહિએ । યદિ આપ ચાએ તો ઉસ મેં આધા નીંબૂડાલ સકતે હૈ ઔર હલકા ગરમ ભી કર સકતે હૈ । પાની પીને કે એક ઘંટે તક કુછ ન ખાએ ।

કૈસે કામ કરતા હૈ ઉષાપાન ?

આપ સોચર હર હોંગે કિ ઉષાપાન સે સભી રોગોં સે કૈસે બચા જા સકતા હૈ ?

હમારે મુંહ મેં છાંનું હોતી હૈ જો લગભગ ૨ લીટર લાર કા ઉત્પાદન પ્રતિદિન એકત્રિત હો જાતી હૈ । યા લાર શારીર (Alkaline) હોતી હૈ જો હમારે શરીર કી અમલ્સા કો દૂર કરતી હૈ । ઇસ લાર મેં હાનિકારક જીવાણુઓં કો મારને કી અદ્ભૂત ક્ષમતા હોતી હૈ । લાર મેં પાચક રસ હોતા હૈ જિસે લાઇસોજાઇમ (Lysozyme) કહતે હૈ । ઇસે ભોજન મેં પાએ જાને વાલે સંક્રમણ તત્વ નષ્ટ હો જાતે હૈ ।

રાતભર જમ હમ સો રહે હોતે હૈ તબ હમારા શરીર અ પને ભીતર કી દિનભર કી થકાવટ, ટૂટુ-ફીટ કો ઠીક કરતા હૈ । ઇસસે કર્ફી પ્રકાર કે વિષ તથા વિષેલે તત્વ (Pre Radicat) ઉત્પન્ન હોતે હૈ । પ્રાતઃ ઉઠકર જબ હમ દો ગિલાસ બાસી પાની પીતે હૈ તબ સબ વિષેલે તત્વ મૂત્ર કે દ્વારા બાહર નિકલ જાતે હૈ । જબ હમ સુબહ ઉઠતે હૈ તો હમારા પૂરા બદન કંડક હો જાતા હૈ, ઇસકા મતલબ વિષેલો તત્વ બાહર નિકલ જાતે હૈ ઔર હમ તરોતાજ્જા અનુભવ કરતે હોય ।

ઉષાપાન કરને સે વાયુ વિકાર, કબજ ઔર બડી આંત કે રોગ જૈસે કોલોઝિટિસ, બવાસીર ઇત્યાદિ ૧૫ દિન મેં હી ઠીક હો જાતે હૈ । માનસિક તનાવ, સિર દર્દ ઔર આંખો કે રોગ એક મહીને મેં ઠીક હોને લગતે હૈ । Kidney કા કાર્ય સૂચારુ રૂપ સે હોતા હૈ ।

અતઃ આપ સે સુબહ ઉઠકર ઉષાપાન કરને કી આદત ડાલિએ, ઇસસે આપ જીવનભર સ્વસ્થ રહેંગે ।

**શતં વષર્ણિ જીવેત । જીવેત શરદાં શતમ્ ।**



સત્ત એટલે શું?

સત્ત એટલે વાસ્તવિકતા, જેમ છે એમ.

કોઈપણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિને આપણી રીતે જોઈએ છીએ, વાસ્તવિક રીતે જોતા નથી. આપણા goggles થી, આપણા અભિપ્રાયોથી, opinions થી જોઈએ છે. આજ અસત, અવાસ્તવિક છે. સત્ત એટલે વાસ્તવિક, Reality, જે જેમ છે એમ. આપણે ટેવાયેલા છીએ આપણી રીતે જોવાથી એટલે હેરાન થવાય છે. વાસ્તવિક રીતે જોતા આવડી જાય તો હેરાનગતિ જેવું આ જગતમાં કાંઈ છે જ નહિ. સત્ત રીતે, વાસ્તવિક રીતે જોતા નથી આવડતું એટલે હેરાન થઈ જવાય છે. ઉપાધ્યાયનો જાપ અસતમાંથી સત્તમાં લઈ જવાવાળો જાપ છે. સત્ત એજ સમ્યક દર્શન છે.

અક્ષર જાપ હંમેશા આપણી અંદર ડંઢદ્વચ નિર્માણ કરે છે. આપણી basic defect છે, એક કામ કરતા કરતા બીજા વિચારોમાં ગરકાવ થઈ જઈએ. આમ જે કામમાં વસ્ત હોઈએ એમાં સમય લાગે અથવા કામ અપૂર્ણ રહે. આપણી આ natural defect છે, કાર્મિક defect છે. આને over power કરવા માટે અક્ષર જાપ કરીએ છીએ. જીવનમાં જે પણ કાર્ય કરતા હોઈએ એમાં focus આવશ્યક છે. મનુષ્ય એક કામ કરતા કરતા બીજે ધ્યાન દોરે એમાંથી ચિંતા થાય, દુઃખ થાય અંતે હારી જાય. કામ અધૂરુ રહી જાય અથવા પૂર્ણ ન થાય. દુઃખ લાગે એટલે થક લાગે, નિરાશ થાય, હારી જાય, દીપ્રેશ થાય અને ન કરવાના વિચાર કરે.

પંચ પરમેષ્ઠિના અક્ષરો ઉપર જાપ કરીએ ત્યારે automatic આપણા focus ની capacity વધે છે. આ સામાન્ય અક્ષરો નથી. બધા power વાળા અક્ષરો છે. દરેક અક્ષરની અંદર એની ગુપ્ત શક્તિ રહેલી છે. પંચ પરમેષ્ઠિના ગુણો આ પદોના અક્ષરમાં રહેલા છે. આવા પદોના જાપ કરવાથી એ અક્ષરોમાં રહેલા ગુણોની શક્તિ આપણાને પ્રાપ્ત થઈ શકે છે.

આપણો ભ્રમમાં છીએ, અસત્તમાં છીએ એજ problem છે. problem માં છીએ એ જોઈ નથી શકતા એ મોટો problem છે. આપણી બધી જરૂરીયાતો પૂરી થાય એટલે ભ્રમ ઉભો થાય કે મને કોઈપણ problem નથી. અનુકૂળતામાં રહીને કહેવું કે problem નથી તો આ બહુ મોટો ભ્રમ છે, માટે પ્રભુએ કહું કે પ્રતિકુળતા એ મારો પ્રસાદ છે. પ્રતિકુળતાના નામે પ્રભુ આપણાને જગાડે છે.

પ્રતિકુળતા આપણાને જગાડે છે અને તર પણ આવી પ્રતિકુળતાઓથી છે. આજ આપણી સમસ્યા છે. આવી પ્રતિકુળતા આપનારથી વધુ નફરત અને તર છે. આ જ software ને change કરવાનું છે. પ્રતિકુળતા એ પ્રભુનો પ્રસાદ છે, અને પ્રતિકુળતા આપનાર ભહાપ્રભુ છે. આજ સત છે અને સમ્યક દર્શન છે. વાસ્તવિકતા છે આપણો બધા પ્રભુ છીએ. આપણાને પ્રભુ નથી દેખાતા કારણ કે આપણી દ્રષ્ટિ શરીરના સર ઉપર જાય છે. જેવી દ્રષ્ટિ શરીર ઉપર જાય

એટલે અભિપ્રાય આવે અને પ્રેમ ન કરી શકીએ.

જેગલના પ્રાણીને જેગલી એટલા માટે કહીએ કારણકે એમનો કોઈ ultimate ધ્યેય નથી. આપણો માનવ જેગલમાં રહીએ, આપણો કોઈ ધ્યેય નથી તો અનંતના પ્રવાસનો ધ્યેય ક્યાંથી સમજમાં આવશે. જેના જીવનમાં કોઈ લક્ષ નથી, સાધ્ય નથી એ ordinary મનુષ્ય છે. Ultimate ધ્યેય એવો હોવો જોઈએ જે વાસ્તવિકતામાં હોય. હું જેમ માનુષ છું, સમજું છું એવી રીતે નહિ કારણકે માનવાને કોઈ end નથી. વાસ્તવિક રીતે સૌથી પહેલા સ્વયંને જોવું કે હું અનંતનો પ્રવાસી છું.

આપણો આ દુનિયામાં શા માટે આવ્યા, આપણી નૈસર્જિક દીઘણ શું છે?

આનંદ પ્રાપ્ત કરવો.

આ આનંદ એટલે સ્વતંત્રતાનો અનુભવ.

ભગવાને મંત્ર માર્ગમાં રસ્તો બતાવ્યો જે પણ universal છે એને પકડો. આ સૂષ્ટિના જે પણ તત્ત્વો છે એ બધા universal છે. નિર્સર્જ જેમ છે એમ એનો સ્વીકાર નથી કરતા એ આપણો problem છે. આપણો બધા નિર્સર્જના અંશ છીએ તે પણ ભૂલાઈ ગયું છે. આપણાને નિર્સર્જથી બહાર જવા માટે કોઈ option છે જ નહિ, પણ આપણો આપણી જાતને બહુ હોંશિયાર સમજ જે નિર્સર્જમાં નથી એ શોધીએ છીએ. આજ મોટામાં મોટો problem છે.

પૂર્ણ નિર્સર્જ બેદભાવ રહિત છે, પરંતુ મનુષ્યે નિર્સર્જમાં પણ પોતાનું અલગ નિર્માણ કર્યું છે. આનાથી જ problem નિર્માણ થાય છે અને વળી કહે છે હું હેરાન છું. મનુષ્ય પોતાની મેળે આ disturbance ખરીદી રહ્યો છે કારણકે nature ના ત્વદ્ધ થી બહાર જઈ રહ્યો છે. આ નિર્સર્જમાં આપણાને બાંધવાવાળો કોઈ નથી. મનુષ્ય મનુષ્યને બાંધે છે. સુખ અને દુઃખ બજેથી જે સ્વતંત્ર છે એનું નામ છે આનંદ. એ સ્વયંભૂ છે. સહજ છે, આનંદને પ્રગટ કરવાનો નથી. આપણા આનંદ ઉપર, આપણી સ્વતંત્રતા ઉપર બંધન આવે એને આપણો દુઃખ ગણિતીએ છીએ, જ્યારે આનંદ એ આપણો મૂળભૂત સ્વતંત્ર રહેવાનો સ્વભાવ છે.

આ life style અહિયા નહી બદલાય તો ફરીથી આગળ આવુ જ repeat થવાનું છે. ભગવાને બહુ ચોખ્યું કહ્યું છે કે રસ્તો દેખાડીશ, સદગુરુ મોકલીશ એમાંથી પારખવાનું, જાણવાનું, સમજવાનું અને અમલ કરવાનું તારે છે. તારેજ તારો રસ્તો શોધવાનો છે, કાઢવાનો છે. ભગવાન કહે છે હું પણ તારી જેમ પ્રવાસી હતો અને ભગવાન બની ગયો. હું જે રીતે ભગવાન બન્યો એ રીતે તને ભગવાન બનાવા માંગું છું.

નમો જિષાણાં.



શુભેચ્છાક :

૫

